

## પરિષદ્-પ્રમુખનો પત્ર

### ક્યાં છે ચિરંતન શિશુત્વ ?

બાળવાત્તાઓના પુસ્તકના લોકાર્પણ-સમારંભમાં જવાનું થયું. ત્યાં જ મારા મનમાં જબકારો થયો : મેં વિપુલ માત્રામાં સાહિત્ય-સર્જન કર્યું છે; સાહિત્યનાં લગભગ બધાં સ્વરૂપો અને પ્રકારોમાં પણ કિંચિત લખ્યું છે, પણ જીવનમાં મારાથી બાળસાહિત્યનો એક અસ્કરેય પાડી શકાયો નથી. સંકલ્પબળથી કદાચ બાળવાત્તા કે બાળકાલો લખી પણ શકાયાં હોતે, પરંતુ તેવું વલણ મુદ્દા વિકસયું જ નહિ. આમ બનવાનાં કારણોનું મેં થોડુંક વિશ્વેષણ કર્યું. પ્રતીત થયું કે બાળસાહિત્ય સર્જવા માટે તેના સર્જકમાં જે માનસિકતા હોવી જોઈએ અને તેનો જે પ્રકારે ઉછેર થવો જોઈએ તેનાંથી હું વંચિત જ રહ્યો. વસ્તુતા : મેં બાળસાહિત્ય વાંચ્યું છે, પણ અલ્ય. મને બરાબર ખ્યાલ છે કે હું બાળપણથી જ એકદરે ગંભીર પ્રકૃતિનો હતો. મારી સાતેક વર્ષની વય સુધી અમે સંયુક્ત કુટુંબમાં રહ્યાં હતાં. પણ, પરિવારમાં ત્યારે બે જ બાળકો હતાં. હું અને મારા કાકાની દીકરી. બહેનનો સ્વભાવ સતતપણ્યો હતો, જ્યારે ઘરના વડીલો જ્યાં બેસીને ગંભીર ભાવે કશીક ચર્ચા કરતાં હોય ત્યારે હું પણ તેઓની વચ્ચે જઈને બેસતો અને કશી સમજ ન પડે તોએ એકગ્રતાથી તેઓની વાતો સાંભળતો. આ જોઈને મારાં દાઈમા બહુ ખુશ થતાં, બોલતાં : ‘આ છોકરો કેવો ડાઢો છે ! મોટા માણસની જેમ તે બધાંની વાતો શાંતિથી સાંભળે છે અને પેતી છોકરી જુઓ !’ પછી અમે અલગ રહેવા ગયાં : પિતાજી, બા અને હું, અહીં તો નિતાંત એકલતા સિવાય મારે માટે કશું હતું જ નહિ. શાળા અને શેરીનાં થોડાંક છોકરાંઓ મારા મિત્રો બન્યા ખરા અને તેઓની સાથે હસવા-રમવાનું થતું, છાતાં તેમાં બાળસહજ રમતિયાળપણું નહિવત્ત હતું. મારા બધા જ રસવિષયો સાવ નાની વયથી ચિત્રકલા, સંગીત, નાટક અને વાંચનમાં ડેન્દ્રિત. આને કારણો મને જાળી તક જ ન મળી. બલકે મેં તેવી તક ઊભી જ ન થવા દીધી.

અને મેં જ્યારે લખવા માંડયું ત્યારે શરૂઆત જ તરુણસહજ કાલ્યો અને પછી વાતાંઓથી કરી. તે પછી પણ મારે બાળસાહિત્ય લખવું જોઈએ એવો કદી વિચાર જ ન આવ્યો. બાળરમતો, પ્રકૃતિની ગોદમાં ગોઠીમડાં, બાળસ્યધાર્થો વગેરેથીયે હું વંચિત રહ્યો. પિંડ તે બ્રહ્માંડ. મેં જાળી શૈશવાનુભૂતિ જ ન કરી. પછી હું બાળમાનસને આલેખતું સાહિત્ય શી રીતે સર્જ શર્કું ? બહુ મુશ્કેલ છે આપણા હદ્યમાં એક ચિરંતન શિશુને જીવિત અને સક્રિય રાખવાનું. રોજિંદા વ્યવહારમાંથે આપણો કેટલી ક્ષણો બાળસહજ નિર્દોષ આવિર્ભાવોને આપી શકતા હોઈશું વારું ? અને હવે તો ખરેખરા બાળકના શૈશવને ઝંધી નાંભે તેવો પરિવેશ કેટલો તીવ્ર બન્યો છે ! સ્વયં આપણે પણ બાળકોને અકાળે પુખ્ત બનાવવાનું જ્ઞાનો-અજ્ઞાનો કામ કરતા હોઈશું. આવી પરિસ્થિતિમાં જેઓ સાચકલું

બાળસાહિત્ય સર્જ છે કહો કે સર્જ શકે છે તેઓને વિશેષ ધન્યવાદ આખ્યા વિના રહી ન શકાય. આ જગતના વધુ ને વધુ રીઢા બન્યે જતા પ્રવાહોમાં સામે પૂરે તરવા જેવી તેઓની સિદ્ધિ છે.

અને જો સર્જક પોતાનામાંના વધાતીત શૈશવને અકબંધ રાખીને બાળસાહિત્ય લખવા કટિબદ્ધ બને તો તેની સમક્ષ કેટલું વિશાળ મેદાન અને કેવી અગાધ સામગ્રી પડેલી છે ! બાળક છે તો મનુષ્યનું સંતાન, પરંતુ સ્વખ્યો, કલ્યાણાંશો, તરંગો, સાહસવૃત્તિ વગેરે દ્વારા તે આપણા જેવા પુખ્ત માનવીઓ કરતાં અનેકગણી વિશાળ અને અસીમ ભાવસુદ્ધિમાં વિહરતું રહે છે. જો બાળકની આ ભાવલીલાને પકડવા જેવું અપ્રદૂષિત સર્જકચિત્ત લેખક-કવિની પાસે હોય તો પછી તેને માટે શક્યતાઓનાં અનેક દ્વારો ઊંઘડી જઈ શકે છે.

મેં ઉપર લખ્યું ને ? મેં બાળપણમાં કે કિશોરવસ્થામાં બાળસાહિત્ય વાંચ્યું જ નથી, પરંતુ તેમાં એક અપવાદ હતો. બકોર પટેલની વાર્તાઓ મેં બહુ રસપૂર્વક વાંચેલી. દાયકાઓ પછી જ્યારે બકોર પટેલની વાર્તાઓની નવી આવૃત્તિના પુસ્તકની પ્રસ્તાવના લખવાનું કામ મને સાંચાયું અને મેં એ વાર્તાઓ ફરીથી વાંચી ત્યારે વર્ચે પડેલા અનેક વર્ષોના અંતરાલને કારણે હું એ વાર્તાઓમાંથી બહુ રસ પ્રાપ્ત ન કરી શક્યો. એમાં વાંક એ વાર્તાઓનો નહિ, મારા રચ્યાસાચ્યા શિશુસહજ મૌગધયના સમય નામના તાત્ત્વે કરેલા વિલયનો હતો. કવિ કલાપીની આ કાચ્યપંક્તિ પ્રસ્તિદ્ધ છે :

**‘સૌદર્યો પામતા પહેલાં સૌદર્ય બનવું પડે.’**

બાળસાહિત્યનું પણ એવું જ છે. સર્જકમાંના શિશુની શાચતી જ તેની પાસે સફળ બાળસાહિત્યનું સર્જન કરાવી શકે.

**ભગવતીકુમાર શર્મા**

૧૬-૮-૨૦૧૧